

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન 2040 સ્પીકર સિરિઝમાં પ્રસ્તુત છે આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત વિશેષજ્ઞો

બ્રેમ્પટન, ઓન્ટારિયો (09 જાન્યુઆરી 2020) – સિટી ઓફ બ્રેમ્પટન તમામ નિવાસીઓને બ્રેમ્પટન 2040 સ્પીકર સિરિઝમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવે છે, જે એક નિઃશુલ્ક અને રોમાંચક પ્રસંગ છે જેમાં આંતરરાષ્ટ્રીય આગેવાનો ભાગ લેશે જેઓ વિશ્વભરના શહેરોમાં પરિવર્તનીય બદલાવનો સંકળતાપૂર્વક અમલ કરી શક્યા છે.

એક કરતા વધુ દિવસના આ પ્રસંગે, બ્રેમ્પટનવાસિઓ દસ વિખ્યાત વક્તાઓને સાંભળશે અને વિચારોની આપલે કરશે કે કેવી રીતે બ્રેમ્પટનની પ્રગતિ સાધવી જેમાં ડેવિડ ક્રોમ્બી અને સ્ટિવન લુવિસનો સમાવેશ થાય છે. હાજર રહેનારા લોકોને બ્રેમ્પટનની રેસ્ટોરાંના વ્યંજનો ચાખવા મળશે (જ્યાં સુધી બચે ત્યાં સુધી) અને સ્થાનિક મનોરંજન માણી શકાશે.

બ્રેમ્પટન 2040 સ્પીકર સિરિઝ એક વધુ મોટી પરિયોજનાનો ભાગ છે જેનું લક્ષ્ય બ્રેમ્પટન 2040 પ્લાન (નવો સત્તાવાર પ્લાન) બનાવવાનું છે. થનાર અનેક પ્રસંગો પૈકી આ એક છે જે બ્રેમ્પટન 2040 વિઝનનું આવતા અઢી દાયકામાં બ્રેમ્પટન કેવું બનશે તેની માત્ર એક કલ્પનામાંથી બ્રેમ્પટનના વિકાસને દોરતા વાસ્તવિક પ્લાનમાં રૂપાંતર કરશે. બ્રેમ્પટન 2040 પ્લાન આવાસ, ઉદ્યોગ, ઓફિસો અને દુકાનોને તેમજ વિકાસ પામતા શહેર માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માર્ગદર્શન આપશે, જેમાં માર્ગો, ઉદ્યાનો, ટ્રાન્ઝિટ, શાળાઓ અને રિક્રિએશનના સ્થળોનો સમાવેશ થાય છે.

બ્રેમ્પટન 2040 સ્પીકર સિરિઝ એક પાછળ એક એવા ચાર બુધવારે હાથ ધરાશે જેની શરૂઆત જાન્યુઆરીની 22મીથી સાંજે 7 થી 9 વાગ્યે થશે. દ્વાર ખુલશે સાંજે 6 વાગ્યે વક્તાઓનો લાઈન અપ આ પ્રમાણે છે:

જાન્યુઆરી 22

કેન ગ્રીનબર્ગ (Ken Greenberg) એક શહેરી ડિઝાઈનર, શિક્ષક અને લેખક છે. તેઓ અગાઉ સિટી ઓફ ટોરોન્ટો ખાતે ડિરેક્ટર ઓફ અર્બન ડિઝાઈન એન્ડ આર્કિટેક્ચર હતાં અને ગ્રીનબર્ગ કન્સલ્ટન્ટ્સનાં ઉપરી હતાં.

ડેવિડ ક્રોમ્બી (David Crombie) 1972 થી 1978 સુધી ટોરોન્ટોના મેયર તેમજ રોયલ કમિશન ઓન દ ફ્યુચર ઓફ દ ટોરોન્ટો વોટરફ્રન્ટના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ આગળ જતા કેનેડિયન અર્બન ઇન્સ્ટિટ્યુટનાં પ્રેસિડન્ટ અને CEO તરીકેની સેવા આપી ચુક્યા છે.

જાન્યુઆરી 29

સ્ટિવન લુવિસ (Stephen Lewis) એ ઓન્ટારિયો લેજિસ્લેટિવ એસેમ્બલીના સદસ્ય તરીકે કાર્ય કર્યું છે, ઓન્ટારિયો ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના નેતા હતાં, સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત હતાં અને UNICEF ખાતે ડેપ્યુટી એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર રહ્યા છે. તેઓ સ્ટિવન લુવિસ ફાઉન્ડેશનનાં સહ પ્રમુખ છે અને આંતરરાષ્ટ્રીય હિમાયતી પ્રયાસોના સંગઠન AIDS-ફ્રી વર્લ્ડના સહ-સ્થાપક અને સહ-પ્રમુખ છે.

ઝારા ઈબ્રાહિમ (Zahra Ebrahim) શહેરો, ડિઝાઇન અને શાસન વ્યવસ્થા માટે ડેલોઇટ(Deloitte)માં એગ્ઝિક્યુટિવ એડવાઇઝર છે અને આખા કેનેડામાં રાજકીય અને સાર્વજનિક પહેલો માટેના વરિષ્ઠ સલાહકાર છે.

ફેબ્રુઆરી 5

બ્રેડ કિંગ (Brad King) લોર્ડ કલ્ચરલ રિસોર્સિસ (Lord Cultural Resources)ના વાર્ષિક પ્રેસિડન્ટ છે જ્યાં તેઓએ 15 કરતા વધુ દેશોમાં 200 કરતા વધુ મ્યુઝિયમ પ્લેનિંગ પ્રોજેક્ટ્સમાં દોરવાણી કરી છે અથવા યોગદાન આપ્યું છે.

ગિલ પેનાલોસા (Gil Penalosa) બિન-નફાકારક સંગઠન 8.80 સિટિઝ (8 80 Cities)ના સ્થાપક અને વર્લ્ડ અર્બન પાર્ક્સ (World Urban Parks)ના એલચી છે. તેઓ આખા વિશ્વમાં નિર્ણયકર્તાઓ અને સમુદાયોને સામલ આપે છે કે કેવી રીતે તમામ લોકો માટે ગતિશીલ શહેરો અને નિરોગી સમુદાયોનું સર્જન કરવું તે ન જોતા કે તેમની વય, લિંગ, ક્ષમતા અને સામાજિક, આર્થિક કે વંશીય પૃષ્ઠભૂ શું છે.

પામેલા બ્લેઇસ (Pamela Blais) એક અર્બન પ્લેનર છે અને મેટ્રોપોલ કન્સલ્ટન્ટ્સના ઉપરી છે તેણી શહેરી સમસ્યાઓના વિશ્લેષણમાં આયોજન, આર્થિક અને પર્યાવરણીય વિચારોનું સાકલ્ય સાધીને તેમજ નવતર નીતિઓનો વિકાસ કરી વધુ સારા શહેરો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ફેબ્રુઆરી 12

આઇએન લોકવૂડ (Ian Lockwood) લિવેબલ ટ્રાન્સપોર્ટેશન ઈજનેર છે જેમણે પોતાની નિષ્ણાત જાણકારી "શહેરનું માળખું" (એટલેકે, સ્ટ્રીટ નેટવર્ક અને ખુલ્લી જગ્યાઓ) પર લાગુ કરી છે જેથી અનેક શહેરી અને પરાની જગ્યાઓ વધુ સારા પરિણામો હાંસલ કરી શકે.

ડેન બર્ડન (Dan Burden) બ્લુ ઝોન્સ (Blue Zones) ખાતે ડિરેક્ટર ઓફ ઈનોવેશન એન્ડ ઈન્સ્પિરેશન છે અને વોકેબલ એન્ડ લિવેબલ કમ્યુનિટીઝ ઈન્સ્ટિટ્યુટ (Walkable and Livable Communities Institute)ના એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર છે જે એક બિન નફાકારક સંગઠન છે જે સમગ્ર ઉત્તર અમેરિકામાં અને વિશ્વમાં કાર્ય કરે છે કે નિરોગી, સંકળાયેલ સમુદાયો સર્જી શકાય.

જો મિનિકોઝી (Joe Minicozzi) એક અર્બન પ્લેનર છે જે જમીનના ઉપયોગ, શહેરી ડિઝાઇન અને અર્થશાસ્ત્ર વિશે વિચારવાની અને વિઝ્યુલાઇઝ કરવાની નવી રીતોની કલ્પના કરે છે. 2017માં જો ની ગણના અત્યાર સુધીના 100 સૌથી પ્રભાવશાળી અર્બનિસ્ટોમાં થઈ હતી.

બ્રેમ્પટન 2040 સ્પીકર સિરિઝ અને બ્રેમ્પટન 2040 પ્લાન વિશે વધુ માહિતી www.brampton.ca/2040speakerseries પર મળશે. રજિસ્ટ્રેશન આવશ્યક છે, પરંતુ ટિકિટો નિ:શુલ્ક છે અને તે માટે અહીં વિનંતી કરી શકાશે.

અવતરણો

"બ્રેમ્પટન 2040 સ્પીકર સિરિઝ એક રોમાંચક પ્રસંગ છે જે બ્રેમ્પટનવાસીઓને વિશ્વ વિખ્યાત આગેવાનો દ્વારા પ્રેરણા મેળવવાની તેમજ આગામી અઢી દાયકામાં બ્રેમ્પટન કેવું થવું જોઈએ તે વિશે વિચારોની આપલે કરવાની તક આપશે. હું તમામ નિવાસીઓને હાજર રહીને પોતાને માટે મહત્વપૂર્ણ હોય એવા મંતવ્યો સંભળાવવા હાંકલ કરું છું. આપણે સહુ સાગમટે બ્રેમ્પટન 2040ના પ્રવાસે છીએ."

-મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

"નિવાસીઓને બ્રેમ્પટન 2040 સ્પીકર સિરિઝમાં હાજર રહેવા અને પોતાની કલ્પનાઓ શેર કરવા આમંત્રણ છે કે સિટી કવી રીતે વધુ ટકાઉ, શહેરી, ગતિશીલ અને આર્થિક રીતે સફળ થાય એવા માર્ગો ઊભા કરી શકે."

- ડેવિડ બેરિક, મુખ્ય વહીવટકર્તા (David Barrick, Chief Administrative Officer)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca